

# જૈન બાળગ્રંથાવલી



શ્રેણી બીજું-૪  
ભારત  
બાળખલિ

: સંપાદક :  
નયાલિખણ



૦૮૭૨ ગ્રંથરત્ન કાર્યાલય ૦

- ગાંધીરસ્તો અમદાવાદ -

જેન ખાલચંથાવલિઃ શ્રેષ્ઠી બીજઃ ૪

# ભરત-ખાહુખલી

લે. શ્રી. નાગકમાર મદતી।

આયોધ્યા નામે નગર છે. રાજ ઋષભદેવ ત્યા રાજ્ય કરે. ત્યાંના લોકોને ઋષભદેવે બધું શીખવ્યું છે. રંધવું કેમ ને સીંધવું કેમ; ખાવું કેમ ને પીવું કેમ; ઊઠવું કેમ ને ઘેસવું કેમ. કામ શીખવ્યું ને કળા શીખવી. રૂડો એવો ધર્મ શીખવ્યો. પછી થયા બધું છોડીને સાધુ. કહેવાયા ભગવાન ઋષભદેવ.

ભગવાનને સો પુત્રો. ભરત સૌથી મોટા. ખાહુખલી એનાથી નાના. અયોધ્યાની ગાદી ભરતને આપી. તક્ષશિલાનું રાજ સોંપ્યું ખાહુખલીને. બીજ બાઈએને બીજ દેશ સોંપ્યા.

ભરતના રાજ્યમાં બધે આનંદ આનંદ. પ્રજાને કોઈ પીડે નહિ ને કોઈ ખરાય કામ કરે નહિ. ચોર લૂંટારાની બીક નહિ. ભરતરાજ ગરીબનો ઘેલી ને દુખિયાનો તારણુહાર.

ભડવીર પણ જેવો તેવો નહિ, તેણે કર્યા વિચાર :

‘લાવ બીજ દેશો જતું ને રાજયોનો પણ  
રાજ થાઉં, ચક્રવર્તી કહેવાઉં. સધળે ધર્મ ફેલાવું.’

તેણે મોટા મોટા હાથી લીધા. પાણીપંથા ઘોડા  
લીધા. શરા એવા સૈનિકો લીધા. લાવ લશકર લઈને  
એ તો નીકળી પડ્યો.

ધણા ધણા દેશ જત્યા. મોટા મોટા રાજયોને  
હરાવ્યા. ઠેર ઠેર આણ વત્તાવી. છ ખંડ જતી  
પાછો ઝર્યો.

ભરત રાજને વિચાર આવ્યો. બધાને જત્યા,  
બાકી રહ્યો એક બળિયો બાહુભલી. પણ તેને જતવો  
શી રીતે ? બાહુભલી જેવો તેવો નહોતો. સિંહ  
જેવો બળવાન ને વાધ જેવો વિકરાળ. જમ જેવા  
તો તેના હાથ. આવાને તે કેમ પહોંચાય ? કોઈથી  
ગાંઝ્યો ન જય. શત્રુઓ એનું નામ સાંભળે તો  
થથરી મરે.

ભરતને ડર પેઢો. હાર થાય તો આખુના  
કંકરા જ થાય ને ! આખી દુનિયાને જતનારો નાના-  
બાઈથી હારે એ તે કેટલી શરમની વાત ! અને કદાય  
જત્યા તોયે શું ! લોકો કહેશો કે નાનાબાઈનું રાજ્ય  
પડાવી લીધું ! આ તો સૂરી વર્ચ્યે સોપારી.

ભરત રાજયે એલાવ્યો પ્રધાનને. કહ્યું, ‘પ્રધાનજી! પ્રધાનજી! સાચી સલાહ આપો. અમારે આવ્યાં ધર્મસંક્ષિપ્ત. એક બાજુ ચક્રવર્તી થવાનો મોહ. ખીજુ પાસ સર્ગો ભાઈ. કયે રહ્યે ચાલવું?’

પ્રધાન કહે, ‘રાજજી! નાનાભાઈને કહેવડાવો કે મોટાભાઈની આજ્ઞા માનો. અમારે નથી જેઠતાં તમારાં રાજપાટ કે નથી ચઢવાં યુદ્ધ. માને તો ટીક. ન માને તો કંઈ ચક્રવર્તીપણું જવા હેવાય?’

રાજ ભરત કહે, ‘સાવ સાચી વાત. મને તમારા એલ ગમે છે. એલચીને મોકલો.’

## ૨

તક્ષશિલાનો દરણાર છે. ભારે ઢાઈ છે. ત્યાં અદ્દલ ન્યાય છે. કીડીને કણું ને હાથીને મળું મળે છે. ન કોઈ હુઃખી છે, ન કોઈ અસંતોષી છે. કામહેવની કાંતિથી દીપતા રાજ બાહુભલી શૂરા સામંતો વરચે ઘેઠા છે. ત્યાં તો આવ્યો રાજ ભરતનો એલચી. વંદન કરી એળે સંહેશ કહ્યો : ‘રાજજી! ભરત છે તમારા મોટાભાઈ. ઘન્ને રીતે તમારે પૂજય છે. માટે માનો એમની આજ્ઞા ને થાવ એમના સેવક.’

બાહુભલી કહે, ‘આજ્ઞા ભગવાન ઋષભહેવની. ભરત મોટાભાઈ ખરા, પણ સેવક થાય એ ખીજ.

બાપનું આપ્યું ભોગવીએ છીએ. અમારે વઢવુંથી  
નથી, ને લડવુંથી નથી.'

એકચી ઘોલ્યોઃ 'રાજરાજેશ્વર ભરતે છ છ ખંડ  
જીત્યા છે. ત્યાં તમારા જેવાનો હિસાબ શો? આજ્ઞા  
માનવી હોય તો માનો, નીકર લડવા માટે તૈયાર  
રહેને.'

આ તો ભારેવાત! વઢ, નહિ તો વઢવા હેઠેવી!

બાહુભ્યલી તો કોધે ભરાયા. રાતીપીળી આંઝો  
થઈ. સિંહની પેઠે ગજ્યો: 'નેથા નેથા તારા રાજને.  
અદ્યા, જઈને કહેજે તારા રાજને, શરીર દેશું  
પણ સ્વમાન નહીં દઈએ. લડવું હોય તો લડવા  
આવે. અમે પણ હાથ ઘતાવી જણુંએ છીએ.'

દૂસ તો પિચારો ડરી ગયો. ભરતહેવને આવીને  
કહે, 'બાપુજી, લડવાનું માંડી વાળો. બાહુભ્યલી  
આગળ આપણું કાંઈ વળવાનું નથી.'

રાજ ભરત શૂરો હતો, છ ખંડનો વિજેતા  
હતો. એમ તે કંઈડરે! તે ઘોલ્યો: 'છ્ય! બાયલા  
હોય તે ડરી જય. વીર પુરુષો તે વળી ડરતા હશે?'

લશકરને હુકમ દીધોઃ 'થઈ જવ તૈયાર. તક્ષ-  
શિલા તરફ કૂચ કરવાની છે.'

ધ્રસક ધ્રસક ઢોલ વાગ્યાં. ગડગડગડ નોષતો

ગગડી રહી. રણભૂમિનાં રણશરીંગાં વાગ્યાં. કુર કુર કુર  
નિશાન કુરક્યાં. ચમક ચમક તલવારો ચમકી. અળક  
અળક બાલા અળક્યા.

કોઈ ધોડા પર તો કોઈ હાથી પર. કોઈ સાંઢળી  
પર તો કોઈ પૈહલ. આખું લશ્કર તૈયાર થઈ ગયું.

ઉંકો હેવાયો ને લશ્કર ઉપદ્યું. દૃમજલ દૃ-  
મજલ કૂચ કરતું તક્ષાશિલા પાસે આવી પહોંચ્યું.  
કોટની બહાર પડાવ નાંખ્યો.

બાહુભલી પણ લશ્કર લઈ નગરબહાર આવ્યો;  
સાથે મહારતા માતંગ લાવ્યો, તેજલા ધોડા લાવ્યો,  
શૂરા સૈનિકો લાવ્યો, બહારુર લડવૈયા લાવ્યો.

સામસામાં એ સૈન્યો ગોઠવાઈ ગયાં. અધઘધ !  
કેટલાં બધાં માણુસો ! જણે મોટો માનવ-મહાસાગર !

રાજ બાહુભલીને વિચાર થયો : ‘લડાઈ તો એ  
ભાઈ વર્ચ્યેની. મોટાઈ અમારે એને જેઠાંને ને  
નકામાં પ્રબન્નાં માણુસોને શા માટે મારવાં ? એ  
જણું જતે જ હિસાબ ચૂકવી લઈએ.’

એણે કહ્યું રાજ ભરતને : ‘મોટાભાઈ ! આપણે  
માટે આ બધા કપાઈ મરે. લોહીની તો નિકો વહે,  
લોહીનો તો દરિયો વહે, કેટલું ખરાબ ! ચાલો  
આપણે એ જ લડીએ. એટાનો નિકાલ લાવીએ.’

રાજ ભરત કહે, ‘સાચી વાત. વિચાર ખડુ સુંદર  
છે. આપણે એ જ લડી લઈએ.’

થથા તયાર. કર્યા લગાવ્યા ને ખાંયો ચઢાવી.

ખન્ને કહે, ‘પહેલું કરીએ દશ્ટિયુદ્ધ.’ દશ્ટિયુદ્ધમાં  
આંખ મીંચાય નહિ ને મીઠ મરાય નહિ. ટગર ટગર  
નેવાનું. પહેલી આંખ મીંચે તે હારે.

દશ્ટિયુદ્ધ શરૂ થયું. આંખો ઝાડી ઊભા રહ્યા.  
આંખની કીકી તો ન હાલે કે ન ચાલે.

ખડુ ખડુ વાર થઈ. આંખો જરા ઝીણી થઈ.  
આંખો જરા ભીની થઈ. ટપ ટપ પાણી ટપક્યું.  
તોય કોઈ મીંચે નહિ. હાર કોઈ ખમે નહિ.

લાલચોળ આંખો થઈ. ઝાડું ઝાડું આંખો થઈ.  
ડોળા જણે હમણુંના નીકળી પડશે. લોહીનાં જણે ઝરણુંના  
વહેશે.

ભરત રાજ પહેલા થાક્યા. તેમની આંખ ઝંખ-  
વાણી. એમની આંખ મીંચાણી. રાજ ખાહુખલી  
જીત્યા. રાજ ભરત હાર્યા!

રાજ ભરત ખૂબ શરમાયા. કેટલી ખધી નામોશી!

હવે ચાલો નાદ્યુદ્ધ કરીએ.

રાજ બાહુભલી કહે, 'મોટા ભાઈ, પહેલો નાદ  
તમે કરો.'

નાદ એટલે અવાજ. નાદ એટલે હોકારો.  
રાજ ભરતે હોકારો કર્યો, જાણે મોટા મેધ ગાજ્યો;  
બારે મેધ સાથે ગાજ્યા. આકાશમાં પડ્યા પડ્યા.  
કાન બહેર મારી ગયા.

બીજો નાદ વીર બાહુભલીએ કર્યો. તીણી  
એવી ચીસ પાડી. ધરતી તો ધ્રૂજ ઉઠી. દશ દિક્કુ-  
પાળો ડાલી ઉઠ્યા. શૂરવીરનાંયે હાજં ગગજ્યા.  
ખળિયો ખંધવ બાહુભલી. ખળિયો એનો હોકારો.

રાજ ભરત આ વખતેથ હાર્યા.

રાજ ભરત હવે ચિડાયા. રેંગે રેંગે રીસ વ્યાપી.  
નસે નસે ઝેર વ્યાપ્યું. બ્યાઘે વખત હાર ! અરે,  
શું નાનોભાઈ મોટાભાઈની, છ ખંડના જીત-  
નારને હરાવશો ?

ભરત રાજ ભાન ભૂલ્યા. તરત મોટા દંડ લીધો.  
જરાખર રીતે દાંત પીસ્યા, કડાક કડાક કચ્છકચ્છાવ્યા.  
ચક્કર ચક્કર દંડ ફેરવ્યો. આગળ ફેરવ્યો—પાછળ  
ફેરવ્યો. સણુણ સણુણ હવામાં વીંજ્યો. જેર કરી  
કુટ્કો માર્યો. બરાખર માથા ઉપર. બાહુભલી ઘેસી

ગયા. ઢીંચણું સુધી જમીનમાં પેસી ગયા. જેવો તેવો તો આ ધાર્થી મરી જ જય.

ખાહુખલીને કળ વળી. ફડાક લઈને ઊઠ્યો. બિહામણી એવી ડાંગ લીધી. આશમાં ભમાવી ને માથા ઉપર લગાવી. સજજડ એનો સપાટો. ભરત તો ભોંય ભેગો થઈ ગયો. તમ્મર આવ્યાં. લાલ પોળાં દેખાવા લાગ્યાં. હુનિયા ઊંધી ચતી દેખાવા લાગી.

મરણુતોલ માર ને શરમનો ભાર. ભરત તો આવા એવડા દુઃખ અધો થઈ ગયો. તેણે ચકુહાથમાં લીધું—ખાહુખલીને વીંધી નાખવા.

યુદ્ધમાં એક નિયમ હોય છે. બન્નેની પાસે હોય તે જ હથિયાર વપરાય. ભરતે નિયમ તોડ્યો. એ ધર્મ ભૂલી ગયો. એણે ચકુ છોડ્યું. સર સર કરતું આવ્યું. પણ ખાહુખલી હતો. સગોભાઈ. સગાભાઈને ચકુ મારે નહિ. ચકુ તો ખાહુખળીની ચારે તરફ આંદ્યા મારવા લાગ્યું.

ભરતે અધર્મ કર્યો. એવાને જીવતો ન મુકાય. ખાહુખલી કહે, ‘મારી નાખું. એક જ મુક્કીએ પૂરો કરું.’ મુક્કી કરી તૈયાર. હાથ ઊંચ્યો કર્યો. મારવા જય છે ત્યાં તો વિચાર આવ્યો :

‘અરે, આ શું? રાજના લોબમાં, મોટાઈના મોહમાં સગા ભાઈને હુણું? અમે કયા બાપના એટા? ધિક છે મને. મેં કુદુંઘ પ્રોણું. ભલે મોટાભાઈ સુષે રાજ લોગવે. ભાઈથી વધુ કોણુ?’

ઉપાડેલી મુદ્દી થોડીવાર જાંચે તોળાઈ રહી. આ મુદ્દીથી ભરતને ન મારું, પણ મારા મનના મોહને જ સંહારું! પિતા ઋષભહેવના પગલે પળું. સંપત્તિ, વૈભવ છાંડી ત્યાંગી થાઉં.

ન એ મુદ્દીથી માથાના વાળ ચૂંટી કાઢ્યા. અન્યા મૂંડ ! રાજપાટ છાંડીને અહવાણે પગે ને ઉધાડે માથે ખાહુખલી તો ચાલી નીકળ્યા.

રાજ ભરતહેવ તો જેઈ જ રહ્યા. ‘ધન્ય છે ભાઈ ખાહુખલી, તને! તેં બાપતું નામ હીપાવ્યું. કુળમાં તું હીવો થયો. તું જીત્યો—ડું હાર્યો. હવે રાજપાટ રંગિકાર, ને મને ધૂટો કર !’

ખાહુખલી કહે : ‘તમે તો છ અંડની ધરતીના ધણી છો. પ્રભનું રક્ષણું તમારો ધર્મ છે. ન્યાય નીતિથી રહેજે. અમે તો આ ચાલ્યા.’

રાજ ભરતહેવે ધાણું સમજાવ્યો, પણ એ તો સાપની કાંચળીની જેમ તજયું એ તજયું.

ભરત ખૂણ રડચો. પણ રડવાથી શું વળે ? રડચે કાંઈ બાહુભલી પ્રત છોડી હે ?

ભરત કહે, 'સાચો વીર બાહુભલી. તેના જેવો કોઈ નહિ. બાહુભલીના પુત્રને તક્ષશિલાની ગાહી આપી ભરત ગયો અયોધ્યા.

૩

બાહુભલીને વિચાર થયો : 'ભગવાન્ ઋષભહેવની પાસે જઉં. તેમની ચરણુસેવા કરું. તેમના પગમાં માથું મૂકું. પ્રભુ મને ઉદ્ઘારશે.' ફરી પાછો વિચાર આવ્યો : 'હમણું જવું ટીકનથી. મારા નાના ભાઈએ ત્યાં છે. તે તો ખૂણ જ્ઞાની છે. વળી તેઓ મારાથી પહેલાં ત્યાળી બન્યા છે, એટલે મારે વંહનીય છે. હું મોટો, નાનાને કેમ નસું ? ના, ના, અહીં રહેશું ને તપ કરશું.'

બાહુભલીએ તો ધોર તપ આરંભ્યાં.

શરીર સુકાઈ ગયું છે. માથે જટા વધી છે. ચારે ગમ ધાસ ઊળ્યું છે. માટીના તો દુંગરા થયા છે. વગડાનાં પશુપંખીએ આવે છે ને એમને હેરાન કરે છે. પણ બાહુભળી નથી હાલતા કે નથી ચાલતા. મૂંગા મૂંગા ધ્યાન કરે છે, સધળાં દુઃખ સહન કરે છે, ન ખાવું કે ન પીવું.

એમનો તો નિશ્ચય અટલ છે.

હાથી જેવી કાયા થોડા હિવસમાં ગળી ગઈ. ભમરા જેવી આંખો, એમાં ઊંડા ખાડા પડ્યા. લીમ જેવું શરીર, તે હાડકાંનો માળો થઈ ગયું. ચંદ્ર જેવું રૂપ પાણી પેઠે ઊરી ગયું. કોઈ ઓળખી ન શકે, કોઈ પિછાણી ન શકે.

આકરું એમનું તપ છે. અહુગ એમનું ધ્યાન છે.

બારથાર મહિના થયા. ત્રણુસો સાઠ હિવસ ગયા તોય સાચું જ્ઞાન મળતું નથી, સાચી સિદ્ધિ સાંપડતી નથી. કર્યું કારવ્યું જાણે એળે જય છે.

ભગવાન ઋષભદેવને ખખર પડી કે બાહુભલી તપ કરે છે. બારથાર મહિના થયા, ત્રણુસો સાઠ હિવસ ગયા તોય એમને જ્ઞાન થયું નથી, સાચું જ્ઞાન મળતું નથી. કારણ શું?

ભગવાને જાહુયું કે બાહુભલીએ બધું છોડ્યું છે, પણ માન છોડ્યું નથી. જ્ઞાન તો વિનયીને મળે, સિદ્ધિ વિવેકીને સાંપડે. માન જે દૂર થાય તો જ સાચું જ્ઞાન થાય. એ વિના બધું ફોક સમજવું.

ભગવાન પાસે એ સાધીએ. શું તેમની તપસ્થા! ને શું તેમનું જ્ઞાન! માયા પંડિતોનેય હરાવે.

અએકનું નામ પ્રાલી. બીજાનું નામ સુંહરી. બજે  
ખાહુખ્લીની બહેનો થાય.

ભગવાન કહે, ‘સાધ્વીએ ! અહીંથી જવ વનવગડે  
ખાહુખ્લીની પાસે. તેને તમે સમજાવો. તેનું માન  
મુકાવો. તેનું તપ નિષ્ઠળ જય છે.’

સાધ્વીએ કહે, ‘જેવી પ્રલુની આજા.’

પ્રાલી-સુંહરી ચાલી; આવી ખાહુખ્લી કને.  
મુનિનો સંયમ જયો. તેમને થયો ભક્તિભાવ. કેવા  
આકરાં તપ ! પ્રેમપૂર્વક વંદન કર્યું. ધીમે રહીને કહ્યું :  
‘હે મારા વીરા, હાથી પરથી હેઠા ઉતરો. જે જેધું  
તે મળશો.’ આટલું કહીને સાધ્વીએ તો ચાલી ગઈ.

ખાહુખ્લીને વિચાર થયો : ‘અહીંયા નથી હાથી કે  
નથી હાથણી. એસવાનું હોય જ કયાંથી ? ભૂમિ ઉપર  
ઉભો છું. ઉભો ઉભો તપ કરું છું. પણ બહેનો જૂદું  
ઓલે નહિ. જૂદું ઓલી છેતરે નહિ. તો ‘હાથી પરથી  
હેઠા ઉતરો’ એનો અર્થ શો ?’

ખૂખ્ય ખૂખ્ય ઊંડા ઊતર્યા. ખૂખ્ય ખૂખ્ય વિચાર  
કર્યો, એટલે કંદ્ધક સમજયું : ‘માન ઝૂપી હાથી છે.  
એના ઉપર હુંઘેઠા છું. માની ના થાયજ્ઞાની. સાધ્વીનું

કહેવું સાચું છે. ચાલ ત્યારે ભાઈએ પાસે જઈં  
તેમનાં દર્શન કરું ને તેમની માફી માગું. '

માન તો બધું ગોળી ગયું છે. ચાલવા પગ ઉપાડે છે  
એટલે થયું કેવળજ્ઞાન. એટલે થયું સાચું જ્ઞાન.

આ બાજુ ભરત રાખ સારી રીતે રાજ્ય કરે  
છે, પ્રભનાં દુઃખ કાપે છે, પ્રભુનાં દર્શને જય છે,  
તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે ને ધર્મધ્યાન કરે છે.

ભરત તો ચક્રવર્તી. એમના નામથી આ ભમિ  
ભરતભમિ કહેવાણી. એમની સાહ્યભીનો પાર નહિ.  
હીરા-મૌતીનો પાર નહિ. ધનના ઢગલા ને રતનના  
બંડાર. હજરો રાજ્યો એમની સેવામાં. દાસદાસી-  
એનો હિસાબ નહિ.

ભરતેશ્વર મોટા હાનેશ્વરી.

તેમણે બાંધી દાનશાળા. દૂર દેશથી લોકો આવે,  
ધન-હીણાને ધન આપે, નવસ્ત્રાને વસ્ત્ર આપે. ઠોર  
આપે ઢાંખર આપે. આપવા જેવું બધું આપે. લેનારો  
થાકે પણ દેનારો તો થાકે જ નહિ.

એક બાંધી લોજનશાળા. જમવું હોય તે જમી  
જય. કોઈને કોઈ રોકે નહિ. ભૂખ્યા લોજન જમતાં  
જય. રૂઢી આશિષ દેતાં જય.

વિદ્યાશાળાએ ને પાઠશાળાએ, કસરતશાળાએ  
ને અભાડાએ ભરતના રાજ્યમાં ટેકેડાણે.

ભરતના રાજ્યમાં સોનાની તો કિંમત નહિ.  
લોકો તો કહેતા, ‘ભરતની પ્રજા જેવી કોઈ પ્રજા  
સુખી નથી. તેના જેવી સમૃદ્ધ નથી. ભરતના જેવો  
ઇન્સાહ નહિ. તેના જેવો ન્યાય નહિ.’ બોગી હોય  
કે બોગી હોય, વૃદ્ધ હોય કે જુવાન હોય, સૌ તેમનાં  
વખાણું કરે.

ભરતે મોટા મહેલો ખંધાવ્યા. અદ્ભુત રચનાવાળા  
ને અદ્ભુત કારીગરીવાળા.

ખંધા મહેલોમાં અરીસાલુવન ખહુ સુંદર. દર્પણુની  
લીંતો, કાચનાં બારીખારણાં ને કાચના થાંબલા.  
શું જળીએ કે શું અટારીએ ! ખંધું જ કાચનું.  
લોંયે દર્પણુ. નળિયાં પણ દર્પણુનાં. જેતાં જ છક્ક  
થઈ જવાય.

ધણી વખત રાજરાજેશ્વર ચક્રવર્તી ભરતહેવ  
આવે ને આનંદ કરે. દર્પણુના હોજમાં નહાય  
ને દર્પણુના કુવારા ઉડાડે. દર્પણુની ખાટે સૂવે.  
દર્પણુની હાંડીમાં રોશની થાય ને મહેલો ખંધા  
અગમગી ઊંઠે.

એક દી રૂડું સનાન કર્યું છે. સુંદર વલો પહેર્યાં  
છે. તેલકુલેલ મહેરે છે ને આભૂષણો શોલે છે.

આવા અરીસાલુવનમાં મોટું રૂપાળું દર્શણ. તેમાં  
મોટું જેયું. કેવું સુંદર! ચંદ્ર જેવી કાન્તિ ને સૂરજ  
જેવું તેજ !

એટલામાં નજર ગાઈ એક આંગળી તરફ, ત્યાં ન  
મળે વીંઠી. આંગળી જેવી આંગળી, પણ ન મળે રૂપ કે  
ન મળે શોલા, સાવ સાહી સટાક !

ભરતહેવને થયો વિચાર : ‘આંગળી લાગે છે ઘેડાળ.  
એક નાનકડી વીંઠી, તેના વિના આટલી ઘેડાળ  
ત્યારે શું આભૂષણોને લીધે જ રૂપ છે? ખરું રૂપ  
જરાય નથી? લાખ્ય, જેવું તો ખરો કે ધરેણું વગર  
ખીલં અંગો કેવાં લાગે છે !’

માથેથી મુગટ ઉતાર્યો. કાનેથી કુંડળ ઉતાર્યાં:  
હાથેથી બાજુખંધ ઉતાર્યાં. કુદેથી કંદોરો ઉતાર્યાં.  
પગમાંથી પાવડીએ કાઢી. ખલેથી એસ કાઢ્યો. બધાં  
ધરેણું દૂર કર્યાં. રૂપ કેટલું બહલાઈ ગયું! પહેલાંના  
કરતાં હજરમાં ભાગનુંયે ના મળે.

ભરતહેવને વિચાર થયો : ‘હું કેટલો મૂર્ખ કે આ  
આય રૂપમાં રાચ્યો. આ બધી બહારની વસ્તુનું જ

રૂપ ! મારું રૂપ કાંઈ નથી ! આ ઓટા રૂપમાં હું રાજ થઈને ભાન ભૂલ્યો. ધિક્કાર છે મને !

એ તો ઊંડા વિચારમાં ઉત્તર્યા : ‘આભૂષણો તો આજ છે ને કાલે નથી. શરીર પણ નાશ પોમવાનું. એનો વળી મોહ શો !’

વિચારમાં શરીર ભૂલ્યા ને મન ભૂલ્યા. બધું ભૂલ્યા. ન ભૂલ્યા એક પ્રભુ. પ્રભુ સાથે પ્રેમ કર્યો.

રૂડો વૈરાગ્ય જગ્યો. હૈયું પવિત્ર થવા લાગ્યું. ને પૂરું પવિત્ર થતાં પ્રગટયું કેવળજ્ઞાન. પહેલાં અધૂરા હતા, હવે પૂરા થયા.

એ રાજ ભરતહેવ અને એ રાજ બાહુભલી. વજથી વધુ કઠોર હતા, પણ કૂલની પાંખડી જેવા કોમળ થયા. વીર તો હતા પણ મહા-વીર થયા.

એવા વીરોની જ જગતને જરૂર છે.

### સુદ્રક :

સુદ્રકમાર ડે. શાસ્ત્રી  
ઇલા પ્રિન્ટરી, માણેકચોક  
શાકમાર્કેટ અમદાવાદ.

# જૈન બાલગ્રંથાપલી

સંપાદક : જયલિખમુ

## પહેલી બ્રેણ્ડી

- ૧ શ્રી. રિખવદેવ
- ૨ શ્રી. પાઠ્રનાથ
- ૩ પ્રભુ મહાવીર
- ૪ મગધરાજ
- ૫ વંદ્નભાગી
- ૬ રાણી ચેલણા
- ૭ જંબુસ્વામી
- ૮ ધ્રાક્તાચીકુમાર
- ૯ અમરકુમાર
- ૧૦ રાજ શ્રીપાળ
- ૧૧ મહાત્મા હંગારી
- ૧૨ વીર ધનો
- ૧૩ વિમળશાહ
- ૧૪ વસુપાળ-તેજ
- ૧૫ જગહુશાહ
- ૧૬ શ્રી. શાનુંજય

## બીજી બ્રેણ્ડી

- ૧ શ્રી. મહિલનાથ
- ૨ નેમ-રાણુલ
- ૩ શ્રી. ગૌતમસ્વામી
- ૪ ભારત આધુનિ
- ૫ આર્દ્રકુમાર
- ૬ અભયકુમાર
- ૭ રાજપિં પ્રસન્નયં
- ૮ મહાસતી અંજના
- ૯ મયશુરેહા
- ૧૦ શાનપંચમી
- ૧૧ અશ્રૂનમાળી
- ૧૨ વન્દતીં સનતકુમાર

## તૃજી બ્રેણ્ડી

- ૧ શ્રી. શાન્તિનાથ
- ૨ શ્રી. ભરતાહુસ્વામી
- ૩ શ્રી. સંઘલિમદ
- ૪ શ્રી. સિદ્ધસેન
- ૫ મહાસતી સીતા
- ૬ સતી મૃગાવતી
- ૭ દ્રૌપદી
- ૮ મુનિશ્રી હરિકેશી
- ૯ શ્રી. નંદિષ્ય
- ૧૦ અક્ષરતૃતીવા
- ૧૧ મહારાજ કુમારમાળ
- ૧૨ ધન્ય અહિંસા
- ૧૩ સત્યનો જય
- ૧૪ એમો હેહરાણી
- ૧૫ મહામંત્રી ઉદ્યોગ
- ૧૬ શ્રી. ગિરનાર

Serving JinShasan



117464

gyanmandir@kobatirth.org

પ્રકાશક : શાંકુલાલ જગર્થીલાઈ : ગુજરાત અધ્યરત્ન દાર્યાલય; ગાંધીરન્તો : અમદાવાદ.

કુદક : સુનુંદરકુમાર કે. શાંકુલાલ, ઈલા પ્રિન્ટરી, મામાની ઝેવેલી ; માંગાનીએ અમદાવાદ